

## **B. Sc SEM -I ની પ્રથમ મેરિટ યાદી (૨૦૧૯-૨૦૨૦) અંગેની સુચનાઓ**

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાની સુચના-માર્ગદર્શિકા અનુસાર [www.sgggu.ac.in](http://www.sgggu.ac.in) પર અમારી સસ્થાનું ONLINE પ્રવેશ ફોર્મ ભરીને નિયત સમયમર્યાદામાં જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સહિત ફોર્મ વેરીફિકેશન કરાવી જમા કરાવેલ તેવા વિદ્યાર્થીઓની **B. Sc SEM-I માં પ્રવેશ માટેની પ્રથમ મેરિટ યાદી કોલેજની**([www.sptgodhra.org](http://www.sptgodhra.org)) વેબસાઈટ પર તેમજ કોલેજના નોટીસ બોર્ડ પર **ગ્રુપ વાઈઝ મુકવામાં આવેલ છે.**

મેરિટ યાદીમાં સમાવેશ પામેલ વિદ્યાર્થીઓને **B. Sc SEM -I માટે ની ફી ભરવાની જરૂરી સુચનાઓ**

- (૧) **B. Sc SEM -I** નિયત ફી ( છોકરા) BOYS માટે Rs.2035/- અને (છોકરીઓ) GIRLS માટે Rs.1435/- **SBI માં** ONLINE ભરવાની રહેશે.ફી કઈ રીતે ભરવાની છે તેની તમામ વિગતવાર માર્ગદર્શક માહિતી કોલેજ ની વેબસાટ તથા નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.તેમ છતાં ખ્યાલ ન આવે તો કોલેજ કાર્યાલયમાંથી જરૂરી માહિતી આપવામાં આવશે.
- (૨) કોલેજ ગ્રાન્ટેબલ હોવાથી નિયત ફી સિવાય ની કોઈ પણ વધારાની ફી કે નાણાંકીય વ્યવહાર કોઈપણ સાથે કરવો નહીં.
- (૩) શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાની સુચના-માર્ગદર્શિકા અનુસાર મેરિટ યાદી ધોરણ 12 ના મુખ્ય ત્રણ વિષય (1) PHYSICS (2)CHEMISTRY (3) BIOLOGY/ MATHS ના ફક્ત થીયેરી માર્ક્સ ના આધારે બનાવવામાં આવેલ છે.તેમાં પ્રત્યેક ટ્રાયલ ના ૧૫ ગુણ બાદ કરવામાં આવેલ છે તથા ગ્રેસ કરેલ માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવેલ નથી જેની નોંધ લેવી.
- (૪) મેરિટ યાદીમાં સમાવેશ પામેલ વિદ્યાર્થીઓ નિયત સયમમાં ફી ભર્યાબાદ ફીની રસીદ તથા ધોરણ 12 ની ઓરીજનલ માર્કશીટ કોલેજ કાર્યાલયમાં જમા કરાવ્યેથી જ પ્રવેશ માન્ય ગણાશે અન્યથા પ્રવેશ માન્ય ગણાશે નહિ જેનીખાસ નોંધલેવી.તેમજ જમા કરાવેલ ધોરણ 12 ની ઓરીજનલ માર્કશીટ તા.૩૧.૦૮.૨૦૧૯ પહેલા પરત આપવામાં આવશે નહિ.
- (૫) **પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ પામેલ વિદ્યાર્થીઓએ** તા.૦૭.૦૬.૨૦૧૯ને શુક્રવારના

રોજ બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં ફી ભરી કોલેજ ખાતે રીપોર્ટિંગ કરી જવાનું રહેશે.ત્યારબાદ તેમનો પ્રવેશ અંગેનો હક્કદાવો રહેશે નહિ.અને બાકી રહેલ ખાલી જગ્યાઓ ભરવા માટેનું બીજું મેરીટ લીસ્ટ તા.૧૦.૦૬.૨૦૧૯ ના રોજ મુકવામાં આવશે.

- (૬) પ્રવેશ કાર્ય યુનિવર્સિટી એ આપેલ ટાઈમટેબલ પ્રમાણે જ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થશે .
- (૭) પ્રવેશ કાર્ય પારદર્શક અને મેરીટ સીસ્ટમથી જ થશે .
- (૮) પ્રવેશ સમયે જાતિના-આવકના-આર્થિક પછાત ના દાખલા કે પ્રમાણપત્રો જરૂરી હશે તે ફરજિયાત આપવાના રહેશે .
- (૯) પ્રવેશ ફોર્મમાં ભરીને માગ્યા મુજબ એક વાર જે વિષય ગ્રુપમાં પ્રવેશ મળ્યો હશે અને ફી ભરી હશે તે વિષય ગ્રુપ સિવાય પાછળથી બીજું વિષયગ્રુપ બદલી આપવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.
- (૧૦) વધુ વિગતો માટે યુનિવર્સિટી તેમજ કોલેજની([www.sptgodhra.org](http://www.sptgodhra.org)) વેબસાઈટ જોતા રહેવું.

સ્થળ: ગોધરા  
તા: ૦૩/૦૬/૨૦૧૯

આચાર્ય શ્રી  
ડો. એમ. બી. પટેલ